



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૧/૦૫/૨૦૧૯ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૭૫/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૩ કેસ કરી, ૨૫ વ્યક્તિઓને ઝડપી, ૨૩૬ લીટર દેશી દારૂ, ૮૩ બોટલ ઇંગ્લીશ દારૂ, ૧૯૧ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ અને ૧૪૪ બિયર ટીન કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૩ કેસ કરી ૯ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૫,૯૨૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૭૬/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૮૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૪ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૮૭૭/૧૯

સોલા હાઈકોર્ટ: દિપક સ/ઓ ઓમપ્રકાશ અગ્રવાલ (રહે. આઈ.સી.બી.આઈલેન્ડ વંદેમાતરમ રોડ ગોતા) એ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૦/૫/૧૯ સાજના ૭/૦૦ વાગ્યાના સુમારે ગોતા બ્રીજની નીચે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના જનરલ પાર્કિંગ આગળ એક એક્ટીવા ઉપર આવેલ બે પુરૂષોએ દિપકભાઈ અગ્રવાલ પાસે આવી જણાવેલ કે પોતે સીઝર છે તેમ કહીને પોતાની સીઝર તરીકેની ખોટી ઓળખ આપીને તમારા પુત્રના એક્ટીવાના ત્રણ મહીનાના હપ્તા બાકી છે જેથી અમે અત્યારે તમારું એક્ટીવા લઈ જઈએ છીએ હપ્તા ભરીને પેઢીમાથી એક્ટીવા છોડાવી જવાનું કહી એક્ટિવા નંબર જીજે ૦૧ યુઈ ૨૧૫૮ કિમત રૂપિયા ૪૫,૦૦૦/- લઈને જઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જે.ડી.પટેલ ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૮૭૮/૧૯

એરપોર્ટ: જયદેવ કિપાલદાસ બચ્ચાની (રહે. સિંધી કોલોની ડો.ચાવલાની લાઇનમા સરદારનગર) એ તા.૨૦/૫/૧૯ નારોજ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૧/૫/૧૯ રાતના ૯/૧૫ વાગ્યાના સુમારે પોતાના રહેણાંક નજીક પાર્ક કરેલ પોતાના એક્ટીવાની ડેકી ખોલી અજાણ્યો પુરૂષ ડેકીમાંથી પર્સની ચોરી કરી લઈ ગયો છે. પર્સમાં રોકડ રૂપિયા ૩,૫૦,૦૦૦/- અને જરૂરી કાગળો હતા. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી આઈ.વી.વ્હોરા ચલાવે છે.

“કે” ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન: સતેન્દ્રકુમારદાસ શીવદયાલદાસ (રહે. ભીમનાથજીની ચાલી સામે પી.ડી.પંડ્યા કોલેજ રોડ વટવા) એ “કે” ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૨૦/૫/૧૯ કલાક ૨/૩૦ વાગ્યાના સુમારે પીરાણા ચાર રસ્તાથી નારોલ સર્કલ તરફ જતા કોઝી હોટલ નજીકથી સતેન્દ્રકુમારદાસના ભાઈ રમેન્દર મિત્ર સાથે એક્ટીવા ચલાવી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક્ટીવા પંચર પડતા ફંફોળાઈ જતા એક્ટીવા પાછળ આવતા ટ્રક નંબર એમએચ ૧૮ એએ ૪૫૬૭ ના ચાલકે ટ્રક પુરઝડપે અને બેદરકારીથી ચલાવી ટ્રક રમેન્દર ઉપર ફરી વળતા રમેન્દરને ગંભીર ઈજાઓ થતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી બી.બી.વાઘેલા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૮૮૦/૧૯

ગોમતીપુર: જાગૃતીબહેન ઉર્ફે જ્યોતીબહેન ડો/ઓ નંદકુમાર મિશ્રા (ઉ.વ.૨૭) (રહે.બાઇ વિસ્કુરની ચાલી ચોકસીની ચાલી સામે મસ્ટર મિલના ગેટ પાસે ગોમતીપુર) એ બિમારીથી કંટાળી તા.૨૦/૫/૧૯ બપોરના ૨/૪૦ વાગ્યાના સુમારે ગોમતીપુર બાઇ વિશકોરની ચાલી ખાતે સંબંધીના ઘરે પંખાના હુકમાં દુપટ્ટે બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ હે.કો.શ્રી અરવિંદકુમાર હરદ્વારસિંહ ચલાવે છે.

રખિયાલ: વિશાલ રાજેશભાઈ ત્રિવેદી (ઉ.વ.૩૦) (રહે.સિધ્ધીવિનાયક સોસાયટી વિભાગ-૨ સાયોના સીટી રોડ ઘાટલોડીયા) ને ગંભીર બિમારી થતા તા.૧૭/૫/૧૯ નારોજ બાપુનગર જનરલ હોસ્પિટલ કામદાર રાજય વિમા યોજના ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બિમારીથી કંટાળી તા.૧૯/૫/૧૯ રાતના ૧૦/૩૦ વાગ્યાના સુમારે હોસ્પિટલના પાંચમાં માળેથી પડતું મુકી આત્મહત્યા કરી હતી. આ અંગે રખિયાલ પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી બળદેવસિંહ રામસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.